



NBV-001-034402 Seat No. _____

M. A. (Sem. IV) (CBCS) Examination

April / May - 2017

Geography : 17 - C 5079

(Morden Geographic Thought - II) (New Course)

Faculty Code : 001

Subject Code : 034402

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) દરેક પ્રશ્ન ફરજિયાત છે.

(૨) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.

૧ આધુનિક યુગ દરમિયાન થયેલા ભૌગોલિક વિચારધારાનો વિકાસ સમજાવો. ૧૪

અથવા

૧ પદ્ધતિસરની પ્રાકૃતિક ભૂગોળના પિતા તરીકે હંબોલ્ટનાં યોગદાનને સમજાવો. ૧૪

૨ ભૂગોળમાં ક્ષેત્રીય વિવિધતા એટલે શું ? તેના લાભ ગેરલાભની ચર્ચા કરો. ૧૪

અથવા

૨ ભૂગોળમાં પ્રકૃતિપ્રભાવવાદ વિરુદ્ધ સંભવવાદની વિચારધારાનાં વિકાસને વિગતે સમજાવો. ૧૪

૩ ભૂગોળમાં ગુણાત્મક ક્રાંતિને કેવી રીતે સ્થાન પ્રાપ્ત થયું ? તેના ગુણદોષ વર્ણવો. ૧૪

અથવા

૩ મોડેલ એટલે શું ? વિવિધ પ્રકારનાં મોડેલનાં નામો વર્ણવો અને તેનો ભૌગોલિક ઉપયોગિતાની દૃષ્ટીએ ગુણદોષ સમજાવો. ૧૪

૪ કાર્ટોગ્રાફી (નકશા વિજ્ઞાન) એટલે શું ? તેનો ખ્યાલ આપી તેના વિવિધ સ્ત્રોત વિષે માહિતી આપો. ૧૪

અથવા

૪	કુદરતી સંસાધનોની ઉપયોગિતા અને સંરક્ષણનું વિગતે વર્ણન કરો.	૧૪
૫	નીચેની ચાર ટૂંકનોંધ પૈકી કોઈ પણ બે ટૂંકનોંધનાં જવાબ આપો : (૧) કાર્લ રીટર (૨) બ્રિટિશ ભૂગોળવેત્તાઓ (૩) ભૂગોળનું ભવિષ્ય. (૪) દૂર સંવેદનની ઉપયોગિતા.	૧૪

ENGLISH VERSION

Instructions : (1) All questions are compulsory.
(2) Draw neat diagram wherever necessary.

1	Examine the development of geographic thought in the modern periods.	14
---	--	----

OR

1	Explain the contributions of Humboldt as the father of systematic physical geography.	14
2	What is an areal differentiation in geography? Discuss its merits and demerits.	14

OR

2	Explain fully the development of 'environmental determinism' versus 'Possibilism' concepts in geography.	14
3	Why did quantitative revolution take place in geography? Describe the merits and demerits of it.	14

OR

3	What is a 'model'? Describe different types of models name. Explain their merits and demerits in geographic applications.	14
---	---	----

4 What is cartography? Give his detail and its various sources. 14

OR

4 State the natural resource utilization and conservation describe in detail. 14

5 Write notes on any **two** of the following four notes : 14

(1) Carl ritter

(2) Britain geographers.

(3) Future of Geography.

(4) Applications of remote sensing.
